

શ્રમ આયુક્તતની કચેરી, ગુજરાત રાજ્ય,

જ્લોકનં-૧૧,૧૨,૧૪, બીજો માળ, ઉદ્યોગભવન,

સેક્ટર-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૧,

Email: asc-bgact-labour@gujarat.gov.in

ક્રમાંક: શ.આ/શા.૭(૫)/PBA/2023-24/૨૧૭૦ થી ૨૧૮૦ તારીખ: ૦૪/૧૦/૨૦૨૪

વિષય:- સને ૨૦૨૩-૨૪ ના વર્ષના બોનસની ચૂકવણી બાબત.

પરિપત્ર

- (૧) આથી તમામ ક્ષેત્રીય અધિકારીઓને જણાવવાનું કે, રાજ્યમાં આવેલ ઔદ્યોગિક એકમો તથા સંસ્થાઓમાં શ્રમયોગી/કર્મચારીઓને બોનસ ચૂકવવાની કામગીરી દિવાળીના તહેવાર પૂર્વે શરૂ કરવામાં આવે છે અને દિવાળી સુધી ચાલતી હોય છે. આથી, તમામ ક્ષેત્રીય અધિકારીઓને પોતાના કાર્ય વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમો તથા સંસ્થાઓમાં સને ૨૦૨૩-૨૪ ના વર્ષના બોનસ ચૂકવણીની કામગીરી પર ચાંપતી નજર રાખવા જણાવવામાં આવે છે.
- (૨) ઔદ્યોગિક એકમો તથા સંસ્થાઓમાં બોનસની ચૂકવણી અંગે માલિકોના મંડળો તથા શ્રમયોગીઓના મંડળો સાથે સતત સંપર્કમાં રહેવા પણ જણાવવામાં આવે છે.
- (૩) ઉપરાંત પોતાના વિસ્તારમાં આવેલા ૧૦૦ કે તેથી વધુ શ્રમયોગી રોકતા, મોટા ઉદ્યોગો, એકમોમાં બોનસની ચૂકવણી બાબતે કોઈ પ્રશ્ન, વિવાદ કે શ્રમ પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના હોય તેવા કિસ્સાઓમાં તાત્કાલિક અગાઉથી જ અસરકારક દરમિયાનગીરી કરી મજૂર પરિસ્થિતિ ન ઉદભવે અને તમામ શ્રમયોગીઓને બોનસની ચૂકવણી થાય તેવી તકેદારી રાખવા જણાવવામાં આવે છે.
- (૪) રાજ્યના તમામ ક્ષેત્રીય સરકારી શ્રમ અધિકારીઓને જણાવવામાં આવે છે કે, તેમના કાર્યક્ષેત્રમાં આવેલ ઔદ્યોગિક એકમો તથા સંસ્થાઓમાં ચૂકવવામાં આવેલ બોનસની માહિતી તા.૧૦/૧૦/૨૦૨૪ ના રોજથી આ સાથે સામેલ નિયત પત્રકમાં (Excel શીટમાં) દરરોજ વિભાગીય નાયબ શ્રમ આયુક્તતશ્રીને મોકલવા અને તમામ નાયબ શ્રમ આયુતશ્રીઓએ સંપૂર્ણ ચકાસણી કરી પોતાના વિભાગની માહિતી સંકલિત કરી આ સાથે નિયત પત્રકમાં જિલ્લાવાર રોજ રોજ આ કચેરીને સાંજના પાંચ વાગ્યા સુધીમાં અચૂક અતે Email-ID: asc-bgact-labour@gujarat.gov.in ઉપર મોકલી આપવા જણાવવામાં આવે છે. ("શૂન્ય" હોયતો શૂન્ય માહિતી પણ મોકલી આપવી ફરજિયાત છે.)
- (૫) જે તે જિલ્લા અધિકારી અલગ-અલગ માહિતી ન મોકલે તેવી તકેદારી રાખી તે અંગે સૂચના સંબંધિતોને આપવા તમામ વિભાગીય નાયબ શ્રમ આયુક્તતશ્રીઓને જણાવવામાં આવે છે. એટલું જ નહિં, સદરહુ માહિતી નિયમિત રીતે CM ડેશબોર્ડ ઉપર રજુ કરવા માટે મોકલવાની રહે છે. જેથી આ સાથેના નિયત નમૂનામાં જ માહિતી અચૂક મોકલી આપવા તમામ વિભાગીય નાયબ શ્રમ આયુક્તતશ્રીઓને જણાવવામાં આવે છે.

(૯) બોનસ ચૂકવણી બાબત શ્રમ પરિસ્થિતિ ઉપરિસ્થિત થાય તો શ્રમ પરિસ્થિતિ અંગેના નિયત ફોર્મમાં અતેની કચેરીની શાખા-૮ ને તે અંગે માહિતી મોકલી આપી થતી પ્રગતિની જાણ રોજે રોજ સાંજના પાંચ વાગ્યા સુધીમાં અચૂક અટે Email-ID: tuaact-labour@gujarat.gov.in ઉપર કરવા તમામ નાયબ શ્રમ આયુક્તતશ્રીઓને તથા સંબંધિત ક્ષેત્રીય અધિકારીશ્રીઓને જણાવવામાં આવે છે. રાજ્યના તમામ ક્ષેત્રીય અધિકારીશ્રીઓને તથા આ કચેરીના સંબંધિત અધિકારીઓ/કર્મચારીઓને આ પરિપત્રની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા ભારપૂર્વક જણાવવામાં આવે છે. જેમાં કસૂર થયે તે અંગે ઉભી થતી જવાબદારી જે તે અધિકારી/કર્મચારીની સંપૂર્ણ અને અંગત રહેશે, જેની નોંધ લેવા તથા પરિપત્ર મળ્યાની પહોંચ પાઠવવા જણાવવામાં આવે છે.

બિડાએ :– ઉપર મુજબ

Gargi
શ્રમ નિયામક,
ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

નકલ રવાના:-

(૧) અધિક શ્રમ આયુક્તતશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

(૨) નાયબ શ્રમ આયુક્તતશ્રી, ગાંધીનગર

(૩) નાયબ શ્રમ આયુક્તતશ્રી, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તરફ.

ઉપરોક્ત બાબતની માહિતી તેઓના કાર્ય વિસ્તારના અધિકારીઓ પાસેથી મેળવી અને સંપૂર્ણ ચકાસણી કરી તેને સંકલિત નિયત પત્રકમાં મોકલી આપવાની સૂચના સહ સદરહુ કામગીરી શ્રમયોગીઓના ઔદ્ઘોગિક શાંતિ તથા માલિકો શ્રમયોગી વરચ્યેના સુમેળ ભર્યા સંબંધોના હિતમાં ખૂબજ અગત્યની હોઈ, માહિતી આ કચેરીને સંતોષકારક રીતે આપવામાં ન આવે ત્યાં સુધી સંબંધિતોને કામગીરીનું સ્થળ નાટી છોડવા જણાવવાનો જરૂરી પ્રબંધ કરવા જણાવવામાં આવે છે. આથી આ કચેરીને આપના દવારા મોકલવામાં આવેલ સંકલિત કરેલી માહિતી જ દ્યાનમાં લેવામાં આવશે.

(૪) મદદનીશ શ્રમ આયુક્તતશ્રી, તમામ.....

(૫) સરકારી શ્રમ અધિકારીશ્રી, તમામ.....

(૬) મદદનીશ શ્રમ આયુક્તતશ્રી અને શાખા અધિકારીશ્રી, શાખા-૮, તરફ જરૂરી કાર્યવાહી સારી.

(૭) શાખા-૭, તમામ કર્મચારી સદરહુ કામગીરી રોજે રોજ સંતોષકારક રીતે પૂરી કરવાની બાબતે તમામ આનુષ્ઠાનિક કાર્યવાહી કરીને રોજે રોજ અને કામગીરી સંપૂર્ણ રીતે પૂરી થાય ત્યાં સુધી હાજર રહી સંઘભાવનાથી કામ કરવાની ભારપૂર્વકની સૂચના સાથે.

(૮) સિલેક્ટ ફાઈલ.